



**MCC-201414**      Seat No. \_\_\_\_\_

**M. A. (Education) (Sem. II) (CBCS) Examination**

**April / May - 2018**

**Psychological Testing - 01 : Paper - IV**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) નીચેના દરેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.  
 (૨) નીચેના દસ પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપો.  
 (૩) નીચેના આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો.

**૧ નીચેના દરેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :** ૧૬

- (૧) સ્તંભાલેખના ચાર ઉપયોગો જણાવો.
- (૨) કલમ પૃથક્કરણ એટલે શું ?
- (૩) મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ સ્પષ્ટ કરો.
- (૪) કોઈ પણ બે પ્રમાણિત કસોટીના નામ જણાવો.
- (૫) શૈક્ષણિક માપનની સંકલ્પના સ્પષ્ટ કરો.
- (૬) મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો જણાવો.
- (૭) વિશ્વસનીયતા એટલે શું ?
- (૮) સહસંબંધ ( $r$ ) = ૦ નું અર્થઘટન કરો.

**૨ નીચેના દસ પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપો :** ૨૪

- (૧) પૂર્વ પ્રારંભિક અજમાયશ એટલે શું ?
- (૨) પ્રમાણિત કસોટીનું સંચાલન કેવી રીતે કરશો ? સમજાવો.
- (૩) મનોવૈજ્ઞાનિક કસોટીઓના ઉપયોગો સ્પષ્ટ કરો.
- (૪) માનાંકોના પ્રકાર સમજાવો.

- (૫) સહવિચરણ પૃથક્કરણની સંકલ્પના વિગતે સ્પષ્ટ કરો.

(૬) શૈક્ષણિક માપનની ઉપયોગીતાઓ જણાવો.

(૭) કસોટીની રચના વખતે ધ્યાનમાં રાખવાની સાવધાનીઓની ચર્ચા કરો.

(૮) માહિતીનું આલેખાત્મક રજૂઆત કરવાની પદ્ધતિઓ જણાવો.

(૯) કસોટી વાપરનારની આચારસંહિતા જણાવો.

(૧૦) મધ્યવર્તી રિસ્થિતિમાનના માપનો અર્થ જણાવો.

૩ નીચેના આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ ૭ પ્રશ્નોના જવાબ આપો : ૩૦

- (૧) યથાર્થતા એટલે શું ? તેના પ્રકારો સમજાવો.
  - (૨) પ્રમાણિત કસોટી રચનાના સોપાનો વિગતે સમજાવો.
  - (૩) સહસંબંધ એટલે શું ? તેના અર્થધટનની રીતો સ્પષ્ટ કરો.
  - (૪) ગુજરાતમાં ઉપલબ્ધ કોઈ પણ એક પ્રમાણિત કસોટીનો પરિચય આપો.
  - (૫) કસોટીનું કલમ પૃથકુરણ કરવાની પ્રક્રિયાનું વર્ણન કરો.
  - (૬) પ્રાચીલીય અને અપ્રાચીલીય કસોટી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
  - (૭) મનોવૈજ્ઞાનિક કસોટીના પ્રકારો સમજાવો.
  - (૮) પ્રમાણિત કસોટીની સંકલ્પના સ્પષ્ટ કરી તેનું સ્વરૂપ અને ઉપયોગો જણાવો.

## **ENGLISH VERSION**

**Instructions :** (1) Answer the following question in short  
(2) Answer any eight from following ten questions.  
(3) Answer any six from following eight questions.

**1 Answer the following questions in short : 16**

- (1) State four uses of Bar Graph.
  - (2) What is item analysis ?
  - (3) Clarify meaning of psychological test.

- (4) State names of any two standardized tests.
- (5) Clarify concept of educational measurement.
- (6) State characteristics of psychological tests.
- (7) What is reliability ?
- (8) Give interpretation of Correlation ( $r$ ) = 0

**2** Answer any **eight** from following ten questions : **24**

- (1) What is pre piloting tryout ?
- (2) How you will make management of standardized test ? Explain.
- (3) Clarify Uses of Psychological tests.
- (4) Explain about types of norms.
- (5) Clarify concept of co variation analysis in detail.
- (6) State uses of educational measurement.
- (7) Discuss precaution for construction of tests?
- (8) State methods of graphical presentation of data.
- (9) State the ethics for users of tests.
- (10) State meaning of Central tendency .

**3** Answer any **six** from following eight questions : **30**

- (1) What is validity ? Explain its types.
- (2) Explain steps for construction of standardize test in detail.
- (3) What is correlation ? Clarify methods for its interpretation.
- (4) Give introduction of any one standardize test available in the Gujarat.
- (5) Describe process for item analysis of test.
- (6) Give difference between parametric test and non parametric test.
- (7) Explain types of psychological tests.
- (8) Clarify concept of standardize test and state its nature and uses.